

Gujarat Lease Financing Limited

(CIN • L65990GJ1983 PLC006345)

GLFL

6th Floor, Hasubhai Chambers,
Opp. Town Hall, Ellisbridge,
Ahmedabad - 380 006.
Ph. : 079-2657 5722 / 2657 5180
E-mail : glflho_ahm@yahoo.co.in

Date: 22nd October, 2020

To, Corporate Relationship Department BSE Limited 14 th Floor, P. J. Towers Dalal Street, Fort, <u>Mumbai-400001</u> SCRIP CODE: 500174	To, Listing Department National Stock Exchange of India Limited "Exchange Plaza", C – 1, Block G Bandra - Kurla Complex, Bandra (East), <u>Mumbai -400051</u> SCRIP SYMBOL: GLFL
--	--

Dear Sir/Madam,

Re: Submission of copies of Newspaper Advertisement regarding intimation of Board Meeting to be held on 31st October, 2020

With Reference to the above, please find enclosed herewith copies of the newspaper advertisement published by the Company in the newspapers i.e. Western Times (English and Gujarati edition) on 22nd October, 2020 regarding intimation of the Board Meeting Scheduled to be held on Saturday, 31st October, 2020.

We request you to please take the same on record.

Thanking you,

For Gujarat Lease Financing Limited

K. P. Patel



Kamlesh Patel

Company Secretary

Encl.: As Above

Gujarat Lease Financing Limited
(CIN • L65990GJ1983 PLC006345)

GLFL

6th Floor, Hasubhai Chambers,
Opp. Town Hall, Ellisbridge,
Ahmedabad - 380 006.
Ph. : 079 2657 5722 / 2657 5180
E-mail : glflho_ahm@yahoo.co.in

Date: 22nd October, 2020

To,
Corporate Relationship Department
BSE Limited
14th Floor, P. J. Towers,
Dalal Street, Fort,
Mumbai-400001
SCRIP CODE: 500174

To,
Listing Department
National Stock Exchange of India Limited
"Exchange Plaza", C - 1, Block G
Bandra - Kurla Complex,
Bandra (East), Mumbai -400051
SCRIP SYMBOL: GLFL

Dear Sir/Madam,

Re: Submission of copies of Newspaper Advertisement regarding intimation of Board Meeting to be held on 31st October, 2020


With Reference to the above, please find enclosed herewith copies of the newspaper advertisement published by the Company in the newspapers i.e. Western Times (English and Gujarati edition) on 22nd October, 2020 regarding intimation of the Board Meeting Scheduled to be held on Saturday, 31st October, 2020.

We request you to please take the same on record.

Thanking you,

For Gujarat Lease Financing Limited

K. P. Patel



Kamlesh Patel

Company Secretary

Encl. : As Above

OYO Hotels & Homes ropes in Sonu Sood as the face of its 'Sanitised Before Your Eyes' campaign

New Delhi, India is moving again, and travel is opening up but differently. Keeping a close eye on the ever-evolving travel trends and customer sentiments, OYO Hotels & Homes launched Sanitised Stays in partnership with Unilever in May 2020 to enhance its sanitisation and hygiene efforts. Taking it a step further, to showcase the hospitality chain's sanitisation efforts in real-time and build trust within travellers, today, OYO launches its integrated campaign - SBYE or "Sanitised Before Your Eyes", with Bollywood actor and OYO asset owner, Sonu Sood as the face of its campaign. This consumer focussed campaign has gone live across TV and digital platforms with its first ad - 'Pehle Spray, Fir Stay' today.

As state borders are opening up to welcome tourists once again, Indians are excited about taking that long due vacation to a

nearby hill station, or drive down to the closest beach, or even enjoy a relaxing staycation within city limits. Travel is certainly back, however, consumers are looking for trustworthy accommodation and practices to ease their concerns, and their worries while fulfilling their travel aspirations. Understanding this, OYO's latest campaign, Sanitised Before Your Eyes aims to give its customers the ease of mind while booking their stays. This is an on-request initiative through which OYO's guests can request the hotel's on-ground staff to sanitise high touch spots or frequently touched surfaces right in front of their eyes.

Speaking about the campaign, Mayur Hoda, Head of Global Brand, OYO Hotels & Homes said, "Trust and love are like chai and biscuit (biscuit sounds better). The Sanitised Before Your Eyes initiative is a brand trust exercise that walks the talk by disinfect-

ing the room in front of a guest's eyes. Our consumers asked this of us in the recent Project Hello we conducted, where we all called and spoke 1:1 to folks to understand their needs today. And we're happy to make it happen.

Commenting on his association with OYO as the brand ambassador, acclaimed Bollywood actor Sonu Sood said, "As an asset partner with OYO, I have a first-hand experience of the proactive efforts of the OYO team over the last few months, not only to ensure safer experiences but also going above and beyond to become a partner in any given guest's journey right from the planning process itself. I believe OYO enables people across the board to travel freely, with its affordable and quality stays spread across the farthest corners of India. When approached to be a part of this initiative, I was immediately on board.

FB moderators 'pressurised' to join office amid Covid surge in India

New Delhi, Amid the surge in Covid-19 cases in India, third-party firms working for Facebook allegedly pressurised the content moderators to get back to work, a report from the non-profit publication 'Rest of World' has claimed.

In Hyderabad, at least 1,600 people are employed by global professional services firm Genpact to do content moderation for Facebook.

"This summer, even as Covid-19 cases were surging in India, Genpact moderators said they felt pressured by their employer to come back to the office," the report said on Tuesday.

"While most of Facebook's full-time employees remain safe at home, these workers have been forced to choose between their health and their livelihoods," it claimed. In a statement shared

with IANS, a Facebook spokesperson said: "Our focus for reopening any office is on how it can be done in a way that keeps our reviewers safe."

"To do this we are putting strict health and safety measures in place, making sure they're followed, and addressing and disclosing any confirmed cases of illness," the spokesperson added.

Rest of World said it spoke with four current and former Genpact employees.

"They said moderators were asked — in some cases as early as July — to return to the office to tackle sensitive content, including posts involving child exploitation, suicide, and other matter that could lead to real-world harm," the report mentioned.

Genpact said in a statement given to the publication that it asserted that moderators are being asked

to come to the office only on a volunteer basis.

"To make this manageable, safe and clear, employees need to sign a weekly form that asks them to voluntarily agree to this," a company spokesperson told Rest of World.

The report quoted a senior content moderator as saying that Genpact employees were informed they could lose their jobs if they didn't come to the office.

"The operations team told them these are important orders," said the moderator. "There's a threatening factor behind (it)."

Facebook had more than 30,000 employees working on safety and security — about half of whom were content moderators.

The social networking giant in May agreed to pay \$52 million to third-party content moderators who developed post-traumatic stress disorder.

Worldwide IT spending to grow 4% in 2021: Gartner

San Francisco, Worldwide IT spending is projected to reach \$3.8 trillion in 2021, an increase of four per cent from this year, according to a forecast by Gartner on Wednesday.

IT spending in 2020 is expected to total \$3.6 trillion, down 5.4 per cent from 2019.

"In the 25 years that Gartner has been forecasting IT spending, never has there been a market with this much volatility," said John-David Lovelock, Research Vice President at Gartner. "While there have been unique stressors imposed on all industries as the ongoing pandemic unfolds, the enterprises that were already more digital going into the crisis are doing better and will continue to thrive going into 2021." Enterprise software is expected to have the strongest rebound in 2021 — 7.2 per cent due to the acceleration of digitalisation efforts by enterprises supporting a remote workforce, delivering virtual services such as distance learning or telehealth, and leveraging hyperautomation to ensure pandemic-driven demands are met.

Spending on data centre systems will experience the second highest of growth of 5.2 per cent in 2021 as hyperscalers accelerate global data center build out and allow staff to be physically back onsite.

Despite the increase in cloud activity in 2020 as organisations shifted to a remote-work-first environment, enterprise cloud spending — which falls into multiple categories — will not be reflected in vendors' revenue until 2021.

NASA spacecraft makes 1st touchdown on asteroid Benu

Washington,

After over a decade of planning, a NASA spacecraft made history after it successfully touched an asteroid to collect dust and pebbles from its surface.

The Origins, Spectral Interpretation, Resource Identification, Security, Regolith Explorer (OSIRIS-REx) spacecraft unfurled its robotic arm on Tuesday in an attempt to collect the sample from asteroid Benu, which is currently more than 321 million kilometres from Earth, NASA said.

"Preliminary data show that today's sample collection event went as planned. More details to come once all the data from the event are downlinked to Earth," NASA's OSIRIS-REx mission said in a tweet.

"After over a decade of planning, the team is overjoyed at the success of today's sampling attempt,"

Dante Lauretta, OSIRIS-REx principal investigator at the University of Arizona in Tucson, said in a statement.

However, it will take about a week for the OSIRIS-REx team to confirm how much sample the spacecraft collected.

Benu offers scientists a window into the early solar system as it was first taking shape billions of years ago and flinging ingredients that could have helped seed life on Earth.

If Tuesday's sample collection event, known as "Touch-And-Go" (TAG), provided enough of a sample, mission teams will command the spacecraft to begin stowing the precious primordial cargo to begin its journey back to Earth in March 2021.

Otherwise, they will prepare for another attempt in January.

"This amazing first for NASA demonstrates how

an incredible team from across the country came together and persevered through incredible challenges to expand the boundaries of knowledge," said NASA Administrator Jim Bridenstine.

"Our industry, academic, and international partners have made it possible to hold a piece of the most ancient solar system in our hands."

At 1.50 p.m. EDT, OSIRIS-REx fired its thrusters to nudge itself out of orbit around Benu. It extended the shoulder, then elbow, then wrist of its 3.35-metre sampling arm, known as the Touch-And-Go Sample Acquisition Mechanism (TAGSAM), and transited across Benu while descending about 805 metre toward the surface.

After a four-hour descent, at an altitude of approximately 125 metres,

the spacecraft executed the "Checkpoint" burn, the first of two maneuvers to allow it to precisely target the sample collection site, known as "Nightingale."

Ten minutes later, the spacecraft fired its thrusters for the second "Matchpoint" burn to slow its descent and match the asteroid's rotation at the time of contact.

It then continued a treacherous, 11-minute coast past a boulder the size of a two-story building, nicknamed "Mount Doom," to touch down in a clear spot in a crater on Benu's northern hemisphere.

The size of a small parking lot, the site Nightingale site is one of the few relatively clear spots on this unexpectedly boulder-covered space rock, NASA said. The sample collected by the spacecraft will return to Earth in 2023.

Facebook sues 4 persons for running fake engagement, ad scams

San Francisco, Facebook has filed lawsuits against four individuals who provided services intended to artificially inflate likes and followers of Instagram accounts, a practice known as fake engagement.

New York-based Sean Heilweil and Jarrett Lusso provided their service using the website boostgram.com while Laila Abou Trabi and Robin Abou Trabi, based in Dubai, used the website instant-fans.com. "Boostgram used a network of bots to automate the delivery of likes and followers of Instagram accounts — a practice known as fake engagement," Facebook said in a statement on Tuesday.

On their website, Boostgram claimed to offer users a way to "increase Instagram exposure" and profited from their services.

Instant-fans.com also

automation software to deliver fake engagement to their customers' Instagram accounts.

"In addition to artificially inflating Instagram likes and followers, Instant-fans.com also offered fake engagement services for Facebook, Twitter, TikTok, YouTube, LinkedIn, Pinterest and other web services," said Jessica Romero, Director of Platform Enforcement and Litigation at Facebook.

They provide fake engagement services to both individual customers as well as other fake engagement services known as "commercial resellers" of fake engagement.

Facebook also enforced against businesses running online scams targeting the users.

"We disabled accounts and sent cease and desist letters to seven businesses located in Asia and Europe that were defrauding online

users who purchased items from their sites. We took these actions based on our users' complaints," the social network informed.

Each of the companies used Facebook and Instagram to post ads for consumer products.

When someone clicked the link in the ad to buy a product, the user was redirected to a third-party website to complete their purchase.

After paying for the item, the user either never received the item or received an item that is different than the item described in the ad. In all cases, people were unable to return items or obtain a refund.

CHANGE OF NAME
I have changed my name from **RANA RAJENDRASINH DIPSINH TO RANA RAJENDRESINH DILIPSINH**
Add : Plot No.727-G, In Farm, Village : Dhanap, Ta & Dist.Gandhinagar-382355
1770

CHANGE OF NAME
I have changed my name from **SAIYED HYDERALI KASAMALI TO SAIYED HAIDARALI KASAMALI**
Add : 113, Gandhini Chali, Behrampur, Ahmedabad
S230

CHANGE OF NAME
I have changed my name from **VAISHALI RAVIKUMAR PATEL TO VAISHALI KEYURKUMAR PATEL**
Add : I/2, Virat Appt, Ghatlodia, Ahmedabad
M059

GUJARAT MARITIME BOARD
(Environment Cell)
Sector-10/A, CHH Road, Opp. Air Force Station, Gandhinagar-382010 Phone : 079-23248733
Fax No.(079) 23234703/3234704
Website : www.gmbports.org

Environmental and CRZ Clearance
Vide Letter No. 10-44/2017-IA.III dated 14th October, 2020, the Ministry of Environment, Forest and Climate Change (Impact Assessment Division), Govt, New Delhi has accorded Environmental and CRZ Clearance for the project of "Incorporation of service jetties and allied facilities at Rozi Pier Port, Jamnagar, Gujarat" to Gujarat Maritime Board, Gandhinagar. Copy of the Clearance letter is available with this office as well as at the GMB's website <http://www.gmbports.org>.
INF/1137/20-21

GUJARAT MARITIME BOARD
(Environment Cell)
Sector-10/A, CHH Road, Opp. Air Force Station, Gandhinagar-382010 Phone : 079-23248733
Fax No.(079) 23234703/3234704
Website : www.gmbports.org

Environmental and CRZ Clearance
Vide Letter No. 10-45/2017-IA.111 dated 14th October, 2020, the Ministry of Environment, Forest and Climate Change (Impact Assessment Division), Govt, New Delhi has accorded Environmental and CRZ Clearance for the project of "Development of Coast Guard Jetty and allied facilities within existing Okha Port, Okha, Devbhumi Dwarka, Gujarat" to Gujarat Maritime Board, Gandhinagar. Copy of the Clearance letter is available with this office as well as at the GMB's website <http://www.gmbports.org>.
INF/1138/20-21

FB moderators 'pressurised' to join work amid Covid surge in India

New Delhi,

As Covid-19 cases surged in India, third-party content moderators working for Facebook allegedly pressurised them to get back to work, a report from the non-profit publication 'Rest of World' has claimed.

In Hyderabad, at least 1,600 people are employed by global professional services firm Genpact to do content moderation for Facebook. "This summer, even as Covid-19 cases were surging in India, Genpact moderators said they felt pressured by their employer to come back to the office," the report said on Tuesday.

"While most of Facebook's full-time employees remain safe at home, these workers have been forced to choose between their health and their livelihoods," it claimed. Rest of World said it spoke with four current and

former Genpact employees. "They said moderators were asked — in some cases as early as July — to return to the office to tackle sensitive content, including posts involving child exploitation, suicide, and other matter that could lead to real-world harm," the report mentioned.

Genpact said in a statement given to the publication that it asserted that to come to the office only on a volunteer basis.

"To make this manageable, safe and clear, employees need to sign a weekly form that asks them to voluntarily agree to this," a company spokesperson told Rest of World.

Facebook responded: "Our focus for reopening any office is on how it can be done in a way that keeps our reviewers safe. To do this, we are putting strict health and safety measures in place,

making sure they're followed, and addressing and disclosing any confirmed cases of illness."

The report quoted a senior content moderator as saying that Genpact employees were informed they could lose their jobs if they didn't come to the office.

"The operations team told them these are important orders," said the moderator. "There's a threatening factor behind (it)."

Facebook had more than 30,000 employees working on safety and security — about half of whom were content moderators.

The social networking giant in May agreed to pay \$52 million to third-party content moderators who developed post-traumatic stress disorder (PTSD) and other mental health issues as they scanned scores of disturbing images of rape, murder and suicide to curb those on the platform.

WESTERN TIMES
Disclaimer
Advertisement appeared in this News Paper have not been verified factually and "WESTERN TIMES" does not stand responsible for the sales proposition.

WESTERN RAILWAY-RAJKOT DIVISION
TENDER FOR REPLACEMENT OF DETECTIVE CABLE
(1) E-Tender No.: DRM-RJT-20-21-SnT-E-05, Dt.: 14.10.2020. Name of Work: Replacement of defective cable in Viramgam-Okha and Wankaner-Maliya Miyana section of Rajkot Division. Approximate Cost: ₹ 6,76,219.20/- EMD: ₹ 13,500/- Tender Cost: ₹2000/- Date & time for online apply: on Dt.: 17.11.2020 upto 15:00 hours. Website particular: www.treps.gov.in Address of the Office: Divisional Railway Manager (S&T), Western Railway, Kothi Compound, Rajkot-360001. RJT-64
Like us on: [facebook.com/WesternRly](https://www.facebook.com/WesternRly)

PUBLIC NOTICE, ENVIRONMENTAL CLEARANCE
It is hereby informed that the state Level Environment Impact Assessment Authority (SEIAA), Panyavaran Bhavan, Sector 10-A, Gandhinagar-382 010, has accorded Environmental Clearance For Setting up Synthetic Organic Chemicals (API and API Intermediates) manufacturing Plant at Plot No. 1279, At & Po - Limbhoi, Ta- Modasa, Dist- Aravalli of M/s. Modasa Pharmaceuticals Pvt. Ltd. vide letter No. SEIAA/GU/EC/S(f)/1148/2020 dated 09/10/2020, under the provision of EIA Notification dated 14th September 2006. Copies of Environmental Clearance letter are available on website of SEIAA, www.seiaa.gujarat.gov.in
AUTHORIZED SIGNATORY
M/s. Modasa Pharmaceuticals Pvt. Ltd.
Date : 22/10/2020

Gujarat Water Supply & Sewerage Board
Nivida No. 48 of 2019-20

Gujarat Water Supply and Sewerage Board invites E-Tender from the Contractor Registered with R & B Irrigation department under Class "E-1" and above for the works of Removing, Providing, Supplying, Lowering and Jointing 406mm dia M.S. Pipeline at Pirana under WSS-6 General Missing link to existing RWSS S.S.W. A-4 RWSS Dist: Ahmedabad. Estimate amount **Rs:31.09 Lakhs ID No: 431743**. The details of Tender are available on website <http://www.nprocure.com> & <http://www.gwssb.org> / <http://www.statetenders.com>. The bidder has to qualify as per qualification Criteria in Tender. The Tender can be downloaded from Date : 20.10.2020 Last date of on-line submission is Date : 03.11.2020 up to 18.00 PM. Additional information can be had from Executive Engineer Public Health Works Division, Ahmedabad 380006 Ph. No. 9978441115-117. The Competent authority retains right to reject to one or all Tender without assigning any reason. **Any query regarding drinking water please contact on Toll free No: 1916.**
No.INF/ABD/842/2020

Bharuch Nagarpalika
Dist: Bharuch

Bharuch Nagarpalika Invite On-line tender Under Road Re-surfacing and Mukhya Mantri sheri sadak yojana Grant for following 1 package of Asphalt Road. Their Estimated Cost range between Rs.1,70,55,400/-. For Details regarding tender Bidders can download the tender from www.statetenders.com & www.nprocure.com. Bidders must bid the tender document by on-line tender process. Nagarpalika will only accept physical tender document through Hand to Hand, RPAID/Speed Post.

Note : GST & EPF No. Must be required.
1) Tender Download Dt. 22.10.2020 to 23.10.2020 till 18.00 PM
2) Physical submission of tender through Hand to Hand, RPAID/Speed post Dt. 23.10.2020 at 18.00 PM
3) Opening of Technical Bid Dt. 23.10.2020 at 18.10 PM

Sanjay G. Soni Chief Officer
Naresh B. Sutharwala Standing Committee
Deepakbhai C. Mistry Chairman PWD Committee
Bharat D. Shah Vice President
Surbhi S. Tambakuwala President
Bharuch Nagarpalika, Bharuch
INF/BCH/429/20-21

Business Brief

Google launches free Stadia game demos

Google has announced that it was offering time-limited and completely free demos for the upcoming Stadia games.

Existing or new Stadia users will be able to play demos of Pac-Man Mega Tunnel Battle, with more coming later this week.

These will be available for a week and won't require a Stadia Pro subscription or even a form of payment to play them, reports The Verge.

Games like Humankind will be available from Wednesday, with an Immortals Fenix Rising demo arriving on Thursday and each demo game will be available for one week free of charge.

A user just need to create a Stadia account and then start playing the game demos streamed from Google's Stadia cloud servers.

Google apparently has more Stadia updates coming later this week, and the company also announced that the critically-acclaimed Star Wars Jedi: Fallen Order will be available for purchase on the Stadia Store on November 24.

In addition, Polish video game developer CD Projekt Red also announced that the Stadia version of the open world role-playing game, Cyberpunk 2077 will launch on November 19 — the same day it is coming to PC, PS4 and Xbox One.

Google announced the game was coming to Stadia all the way back in August 2019, but didn't reveal a final release date.

Snapchat hits 249mn daily users, sales up 52% in Q3 2020

San Francisco,

Snapchat saw its daily active user base jump to touch 249 million, from 238 million in last quarter, as the company registered a 52 per cent increase in revenue at \$679 million in its third quarter.

The stock of its parent company Snap rose 17.1 per cent after bumper quarter results. Operating cash flow improved by \$21 million to \$55 million in Q3 compared to the prior year.

"Our focus on delivering value for our community and advertising partners is yielding positive results during this challenging time. We're excited about the growth of our business in Q3 as we continue to make long-term investments in our future," CEO Evan Spiegel said in a statement late on Tuesday.

"The adoption of augmented reality (AR) is happening faster than we had previously anticipated, and we are working together as a team to execute on the many opportunities in front of us," he added.

The average number of Snaps created every day grew 25 per cent year-over-year.

Total daily time spent by Snapchatters watching Shows increased by over 50 per cent year-over-year in its third quarter.

"The daily average number of Snapchatters in India watching Discover content increased by nearly 50 per cent sequentially in Q3 2020," the company announced.

As of the end of Q3, over 1.5 million Lenses have been created through Lens Studio.

"Our Anime Style Lens powered by real time machine learning was engaged with 3 billion times in its first week," the company informed.

Snap said it helped over one million Snapchatters with voter registration for the 2020 US election through its 'Register to Vote' Mini, developed in partnership with Democracy Works.

GUJARAT LEASE FINANCING LIMITED
CIN: L65990GJ1983PLC006345
Registered Office
6th Floor, Hasubhai Chambers, Opp. Town Hall, Ellisbridge, Ahmedabad - 380006
Phone No.: 079-26575222, 079 - 26575180
Website : www.gujaratleasefinancing.co.in/, E-mail : glfho_ahm@yahoo.co.in

NOTICE
In terms of Regulation 29(1) read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, it is hereby notified that meeting of the Board of Directors of the Company is scheduled to be held on Saturday, 31st October, 2020, *inter-alia*, to consider and approve the Un-audited Financial Results for the quarter and half year ended on 30th September, 2020.
The said notice may be accessed on the Company's website: www.gujaratleasefinancing.co.in/ and may also be accessed on the website of Stock Exchanges at www.nseindia.com and www.bseindia.com.
For Gujarat Lease Financing Limited
Kamlesh Patel
Company Secretary
Place : Ahmedabad
Date : 21st October, 2020

WESTERN RAILWAY TO RUN ONE MORE FESTIVAL SPECIAL TRAIN BETWEEN GANDHIDHAM AND TIRUNELVELI



Train No.	Departure	Arrival	Dates of Service
09424	Gandhidham 14.00 hrs. (Monday)	Tirunelveli 11.30 hrs. (Wednesday)	w.e.f 26.10.2020 to 30.11.2020
09423	Tirunelveli 07.45 hrs. (Thursday)	Gandhidham 06.40 hrs. (Sat) upto 31.10.2020 (Monsoon) 04.30 hrs. (Sat) from 01.11.2020 (Non-Monsoon)	w.e.f 29.10.2020 to 03.12.2020

Halts : Ahmedabad, Vadodra Jn., Surat, Vasai Road, Panvel, Roha, Ratnagiri, Madgaon Jn., Karwar, Thokur, Mangaluru Jn., Kozhikode, Shoranur Jn., Thrissur, Ernakulam Jn., Kayankulam Jn., Thiruvananthapuram Central, Nagercoil Town stations in both directions.
Composition : AC 2-Tier, AC 3-Tier, Sleeper Class and Second class seating coaches.

The booking of Train No. 09424 will open from 23.10.2020 at nominated PRS Counters and on IRCTC website. This train will run as fully reserved train.

WESTERN RAILWAY
www.wr.indianrailways.gov.in
Like us on: [facebook.com/WesternRly](https://www.facebook.com/WesternRly)
Follow us on: twitter.com/WesternRly
Please carry ID proof for all Reserved Tickets

